

**B.Com. Semester - 6 (CBCS) Examination
March/April-2026 (NEW COURSE)
Indirect Tax Law-2 (Dse-3 (New))**

Time: 2:30 Hours**Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન.૧ GST હેઠડ નોંધણીની પ્રક્રિયા વર્ણવો. (૨૦)
અથવા
- પ્રશ્ન.૧ GST નોંધણી રદબાતલ વિધિ જણાવો અને રદ થયેલ નોંધણી પરત ખેંચી લેવા અંગેનું કાનૂની માર્ગદર્શન સમજાવો.
- પ્રશ્ન.૨ સમજાવો : (૨૦)
(A) બિલ ઓફ સપ્લાય (B) પેમેન્ટ વાઉચર
અથવા
- પ્રશ્ન.૨ ઇનપુટ ટેક્સ ક્રેડિટ નો ખ્યાલ સમજાવો અને પાત્ર -અપાત્ર ઇનપુટ ટેક્સ ક્રેડિટ વિશે સ્પષ્ટતા આપો.
- પ્રશ્ન.૩ કસ્ટમ કાયદાનો ખ્યાલ સમજાવી તેની બંધારણીય જોગવાઈઓ જણાવો. (૧૫)
અથવા
- પ્રશ્ન.૩ કસ્ટમ કાયદા મુજબ સમજાવો.
(A) ભારતીય ખંડીય છાજલી (Continental Shelf of India)
(B) ભારતીય પ્રાદેશિક પાણી (Territorial water of India)
- પ્રશ્ન.૪ નોંધ લખો (કોઈપણ બે) (૧૫)
(1) મૂળભૂત કસ્ટમ ડ્યુટી
(2) વધારાની ડ્યુટી (Additional Duty)
(3) ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વળતર સેસ
(4) એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી

ENGLISH VERSION

- Que.1 Describe the registration procedure under GST. (20)
OR
- Que.1 State the procedure of cancellation of GST registration and explain the legal guidance about the revocation of cancellation registration.
- Que.2 Describe : (20)
(A) Bill of Supply (B) Payment Voucher
OR
- Que.2 Explain the concept of Input Tax Credit and give clarification in regards to eligible and ineligible Input Tax Credit.
- Que.3 Give concept of Custom Law and explain its constitutional provisions. (15)
OR
- Que.3 Discuss in detail following as per consumer protection Act 1986.
(A) Continental Shelf of India
(B) Territorial water of India
- Que.4 Write note (Any Two) (15)
(1) Basic Custom Duty
(2) Additional Duty
(3) Goods and Service Tax Compensations Cess
(4) Anti- Dumping Duty
